

જુલાઈ 25, 2018

બ્રામ્પટનમાં નવા રહેવાસી છો? એક બસ પ્રવાસ મફતમાં મેળવવા નોંધણી કરાવો!

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સીટી ઓફ બ્રામ્પટન પોતાના નવા રહેવાસીઓને શહેરનો ઇતિહાસ અને સુલભ સેવાઓની માહિતી આપવા મંગળવાર, ઓગસ્ટ 21 અને ગુરુવાર, ઓગસ્ટ 23 નાં રોજ, મફતમાં, સર્વે કુટુંબીજનોને અનુકૂળ એક બસ પ્રવાસ કરાવવાનું છે.

આ શહેરના રિક્રિએશન ડિવિઝન, બ્રામ્પટન ટ્રાન્ઝિટ અને બ્રામ્પટન લાઈબ્રેરી (પુસ્તકાલય) વચ્ચેની ભાગીદારી મારફતે આ એવોર્ડ-વિજેતા સામુદાયિક કાર્યક્રમ આ શહેરે વર્ષ 2009 થી આપ્યો છે.

ત્રણ કલાકના પ્રવાસની વિગતો નીચે જણાવ્યા મુજબ છે:

- મનોરંજનની તકો અને સુલભ સુવિધાઓને લગતી માહિતી જાણવા એક સામુદાયિક કેન્દ્રની (રિક્રિએશન સેન્ટરની) મુલાકાત લેવી
- ઉપલબ્ધ વિવિધ સંસાધનો અને તેની પલ્લોચ કેવી રીતે મેળવવી તે શોધી કાઢવા છ (6) માંથી એક પુસ્તકાલય શાખાનું નિરીક્ષણ કરવું
- બ્રામ્પટન ટ્રાન્ઝિટ બસની સવારી કરવી અને બ્રામ્પટન ટ્રાન્ઝિટનો નક્શો, PRESTO (પ્રેસ્ટો) ફેર (ભાડાના) કાર્ડ્સના લાભો અને મુસાફરોને ક્યારે પરિવહન સગવડ બદલવાની જરૂર પડે છે, તેને લગતી હાથવગી માહિતી મેળવવી

આ પ્રવાસોનો હેતુ આ મુદ્દાઓને શૈક્ષણિક અને આનંદમય રાખવા ઉપાણાઓ અને ઇનામોથી, માહિતીપ્રદ રહેવાનો અને મનોરંજન પૂરું પાડવાનો છે.

નોંધણી હવે ચાલુ છે! જાન્યુઆરી 1, 2015 પછી બ્રામ્પટનમાં વસેલા રહેવાસીઓને આ પ્રવાસોમાં હાજર રહેવાનું નિમંત્રણ છે. વધુ માહિતી મેળવવા, બ્રામ્પટન લાઈબ્રેરીનો સંપર્ક 905.793.4636 નંબર પર કરો, કોઈ બ્રામ્પટન પુસ્તકાલય શાખાની મુલાકાત લો, અથવા વેબસાઈટ www.brampton.ca/recreation જુઓ.

અવતરણ (ક્વોટ):

“આ બસ પ્રવાસો નવા બ્રામ્પટન રહેવાસીઓ માટે તેઓના રોજિંદા જીવનમાં સહાયરૂપ અને સુદૃઢ મ્યુનિસિપલ સેવાઓ અંગેની માહિતી વડે તેઓને આવકારવાની એક નવીન રીત છે. આ કાર્યક્રમમાં આપવામાં આવતું સુલભ શિક્ષણ અને અંગત સહાનુભૂતિ અહીં સ્થાયી થતી દરેક વ્યક્તિ માટે આપણાં શહેરને વધારે અનુકૂળ શહેર બનાવવામાં મદદ કરે છે.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

-30-

બ્રામ્પટન વિશાળ આયોજનો વિષે વિચારો છે. અમે તીક્ષ્ણ ફેક્સ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઇનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રામ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://www.facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

